

DISHA RESOURCES LIMITED

CIN: L74110GJ1995PLC024869

Registered office: 3, Rajesh Apartment, B/h, Ajanta Comm. Estate

Off Ashram Road, Ahmedabad-380014

Contact: 079-2754-0790, 079-27543060

E-mail: disharesourceslimited@gmail.com **Website:** www.disharesourcesltd.com

DRL/SE/2024-25/P82

February 15, 2025

To,

The Manager, Listing

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, Mumbai- 400 001

SYMBOL: DRL

ISIN: INE193D01019

CODE: 531553

Dear Sir/Madam,

Sub.: Publication of unaudited Standalone Financial Results for the third quarter ended as on 31st December, 2024

Ref: Company Code: BSE: 531553

With regard to above and in compliance with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of Free Press Gujarat (English) and Lok Mitra (Gujarati) edition dated February, 14th 2025 in which unaudited Standalone Financial Results for the third Quarter ended as on 31st December, 2024 as approved in the meeting of the Board of Directors held on 14th February, 2025 were published.

You are requested to please take note of same.

Thanking You,

Faithfully Yours,

FOR DISHA RESOURCES LIMITED

DHWANI NAGAR

COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER

M.NO: 71158

ENCL: As Above

Honking are a menace

The whole world is alarmed at air, water and land pollution. There's a deafening silence about noise pollution. Be it human or machine-created, noise disrupts normal activity and balance of life. Honking by motorists is the largest source of noise pollution in the India. The menace of honking is increasing day-by-day in Metro cities in particular, aggravating noise pollution resulting in serious health hazards.

The indiscriminate use of the horn is due to lack of patience of road users to follow rules and regulations. Everybody wants to reach everywhere first! In other countries, honking is considered uncivilised, but in the Indian context, a cultural scene is attached to it.

Indiscipline is the root cause of such rash driving using the power of one's shrill horn. Our growing sumptuousness makes us more anti-social, and loud obnoxious public behaviour appears to be the norm. It is a way of overcoming our selfish ways and paying attention to courtesy and developing a civic sense on the roads. Many drivers take it as child's play in honking without considering its seriousness, thereby inviting unnecessary rage and resentment of the public. While many drivers route to using the horn unnecessarily due to a lack of awareness regarding the negative effects of noise pollution; however, most of them do it only due to the lack of civic sense.

Motorists are also eager at traffic signals. They use horns terribly and unnecessarily to seek way at intersections, roundabouts and at jam-packed stretches. In terms of creating noise pollution in cities, auto-rickshaws rank on top. One is sure to hear a dozen horns barking at him if his car does not budge the moment lights turn green. The menace of honking is especially rampant in residential

colonies wherein youngsters make excessive use of horn continuously while riding bikes just to flaunt their flashy vehicles. In India, where people drive recklessly and where there are no clear traffic rules for people to follow, the horn is the only thing that drivers can rely on, while cautioning other drivers and while trying to have their way. Also, the politicians' vehicles use the loudest of horns. Vehicles that have party flag think that they have the extra rights over the road than others. Motor and driving culture has to be imbibed in the education itself. Courteous driving is the best way to avoid stress while driving. According to unclassified, but in the Indian context, a cultural scene is attached to it.

Indiscipline is the root cause of such rash driving using the power of one's shrill horn. Our growing sumptuousness makes us more anti-social, and loud obnoxious public behaviour appears to be the norm. It is a way of overcoming our selfish ways and paying attention to courtesy and developing a civic sense on the roads. Many drivers take it as child's play in honking without considering its seriousness, thereby inviting unnecessary rage and resentment of the public. While many drivers route to using the horn unnecessarily due to a lack of awareness regarding the negative effects of noise pollution; however, most of them do it only due to the lack of civic sense.

Motorists are also eager at traffic signals. They use horns terribly and unnecessarily to seek way at intersections, roundabouts and at jam-packed stretches. In terms of creating noise pollution in cities, auto-rickshaws rank on top. One is sure to hear a dozen horns barking at him if his car does not budge the moment lights turn green. The menace of honking is especially rampant in residential

Nykaa Makes Its Streaming Debut with Nykaa Wali Shaadi on JioCinema



Ahmedabad. Beauty meets love in Nykaa Wali Shaadi, a heartwarming series that follows four real brides as they step into their dream bridal looks, crafted with Nykaa's expert beauty touch. Streaming now on JioCinema, this Tiger Telly and Nykaa production captures the emotional and transformative journey of each bride, from moonboarding their vision to the final reveal—a moment filled with love, tradition, and pure joy.

After battling breast cancer Seema Priyanka Gowdar - A decorated army officer embracing her moment to shine after years of service. Maiti Shahani Kapoor - A cross-cultural love story blending Nepali-Sindhi and Parsi-Punjabi traditions. Avantika Chhabria - A love story years in the making, proving that soulmates can be manifested. A celebration of beauty, emotions, and big dreams, Nykaa Wali Shaadi is a must-watch for anyone who believes in the magic of weddings. Now streaming on JioCinema!

IESA Views on India US Joint statement

Ahmedabad. The recent India-U.S. bilateral engagement, following Prime Minister Modi's visit and meeting with President Trump, reaffirmed a shared vision of the relationship as pivotal to global stability and prosperity. This partnership has grown into one of the most significant in the 21st century, addressing strategic, economic, and technological priorities.

Key Long-Term Impacts of the Modi-Trump Meeting: Strengthened Bilateral Relations in Technology and Energy. Strategic Convergence on China. Expansion of Trade and Investment Opportunities. Despite ongoing challenges,

Water supply disruption in key Ahmedabad areas due to pipeline connection work

Ahmedabad residents in several key areas including Shilaj, Bopal, Ghuma, Makhampura and Sarkhej wards will face water supply disruptions on Wednesday evening due to crucial pipeline connection work being undertaken by the Ahmedabad Urban Development Authority (AUDA). Normal water supply is expected to resume on Thursday morning, subject to available quantity. The shutdown is necessary to

facilitate the connection of a newly laid water pipeline to the existing 1,600 mm diameter trunk main line, which was relocated to make way for the construction of an underpass. This underpass project, initiated by AUDA, required the existing pipeline to be shifted, prompting the need for integration work. The connection work is focused on the existing 1600 mm diameter trunk main line at Ognaj Circle. The scope of the work includes: Connecting

the newly laid pipeline from Vaishnoverhead tank to the existing 1600 mm trunk main line that supplies water towards Sardar Patel Ring Road. Integrating the new 2,500 mm diameter Mild Steel (MS) trunk main line from the Jaspur Water Treatment Plant to the existing main pipeline. This trunk main runs parallel to Sardar Patel Ring Road and plays a critical role in Ahmedabad's water distribution network.

SHUBHAM POLYSPIN LIMITED				
(CIN: L17120G2012PLC069319)				
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jetपुरa-Bansapurta Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)				
E-Mail ID: ankit@shubhamgrp.com Website: www.shubhampolyspin.com				
UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2024 (Rs. In Lakhs)				
Particulars	Quarter ended on 31-12-2024 (Unaudited)	Quarter ended on 30-09-2024 (Unaudited)	Quarter ended on 31-12-2023 (Unaudited)	Year ended on 31-03-2024 (Audited)
Total Income from operations	1480.71	1498.97	1136.91	5076.56
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	20.09	16.80	27.12	123.29
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	20.09	16.80	27.12	123.29
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	18.51	12.02	20.09	86.43
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	18.51	12.04	20.09	86.46
Equity Share Capital	1212.20	1212.20	1212.20	1212.20
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	-	234.54
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations): (a) Basic & (b) Diluted	0.15	0.10	0.17	0.69

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.
2. The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the website of the Company. (www.shubhampolyspin.com).
3. Exceptional and/or Extraordinary items as defined in the Statement of Profit and Loss in accordance with IAS- Rules.

Date: 14th FEBRUARY, 2025
Place: BORISANA

FOR, SHUBHAM POLYSPIN LIMITED
ANIKT ANIL SOMANI
MANAGING DIRECTOR (DIN: 05211800)

Arman Holdings Limited

Arman Holdings Limited						
(CIN: L65993G1982PLC082961)						
Registered Office: Office No.106, Sanskruti AC Market, Pavat Godadara BRTS Road, Pavat Patla, Surat - 391050. Tel: 9586006592. Email ID: armanholdings@gmail.com Website: www.armanholdings.in						
Extracts of Standalone Unaudited Financial Results for the Quarter and Nine Months Ended 31/12/2024 (Amt. Rs. In Lakhs)						
Particulars	3 months ended 31/12/2024 (Unaudited)	Preceding 3 months ended 30/09/2024 (Unaudited)	3 months ended 31/12/2023 (Unaudited)	Year to date for the period ended 31/12/2024 (Unaudited)	Year to date for the period ended 31/03/2024 (Unaudited)	Year to date for the period ended 31/03/2023 (Audited)
Total Income from operations	0.01	0	24.34	0.01	363.95	439.33
Profit before exceptional and extraordinary items and tax	-4.13	-3.29	0.09	-14.39	1.42	2.43
Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items #)	-4.13	-3.29	0.09	-14.39	1.42	2.43
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	-4.14	-3.21	0.08	-14.31	1.10	1.82
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-4.14	-3.21	0.08	-14.31	1.10	1.82
Equity Share Capital (face value of Rs.10/- each)	521.05	521.05	521.05	521.05	521.05	521.05
Reserve per equity shares (after extraordinary items) Basic:	-0.08	-0.06	0.002	-0.28	0.03	0.05
(a) Diluted	-0.08	-0.06	0.002	-0.28	0.03	0.05
Other Equity Reserves per equity shares (after extraordinary items) Basic:	-0.08	-0.06	0.002	-0.28	0.03	0.05
Diluted:	-0.08	-0.06	0.002	-0.28	0.03	0.05

Notes:
1. The above results is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the stock exchange website, i.e., www.bseindia.com and company's website, i.e., www.armanholdings.in.

Date: 14/02/2025
Place: SURAT

For Arman Holdings Limited
Deepak Kumar Babel
Managing Director
DIN: 05200110

MEHTA INTEGRATED FINANCE LIMITED

MEHTA INTEGRATED FINANCE LIMITED				
(CIN: L65910G1985PLC007692)				
Reg. Off: 003, Law Garden Apartment, Scheme-1, Law Garden, Elmhurst, Ahmedabad - 380006 E-mail: 1mfl_in@gmail.com • Website: www.mehtaintegratedfinance.com • Phone: 9377578519				
Extract of Statement of Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2024 (Rs. In Lakhs except EPS)				
Sr. No.	Particulars	Quarter ended		
		31-12-2024	31-12-2024	31-12-2023
1	Total Income	28.45	72.84	115.58
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and Extraordinary items)	10.37	23.62	(2.77)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and Extraordinary items)	10.37	23.62	(2.77)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and Extraordinary items)	10.37	23.62	(2.77)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	10.37	23.62	(2.77)
6	Equity share capital (face value of INR 10)	500.00	500.00	500.00
7	Reserve excluding Revaluation Reserve	-	-	-
8	Earning per share (before and after extraordinary items) Basic & Diluted:	0.21	0.47	(0.06)

Notes:
1. The above is an extract of the detailed format of Quarter/Nine months ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarter/Nine Month Unaudited Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and also on the Company's website www.mehtaintegratedfinance.com.
2. Above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on February 14, 2025.

Date: 14-02-2025
Place: Ahmedabad

For, Mehta Integrated Finance Limited
Vishwesh D. Mehta
Managing Director & CFO
(DIN: 00484785)

DISHA RESOURCES LIMITED

DISHA RESOURCES LIMITED						
REGD. OFFICE: 3, RAJESH APARTMENT, B/H, AJANTA COMM. ESTATE, ASHRAM ROAD, AHMEDABAD-380014						
PHONE: (OFF), 2755-0790. 27543060 E-MAIL: disharesourceslimited@gmail.com CIN: L74110G1995PLC024869 Website: www.disharesourcesltd.com						
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER ENDED AS ON 31ST DECEMBER, 2024. (In Lakhs except EPS)						
PARTICULARS	Quarter ended			Nine months ended		
	31-Dec-24 (Unaudited)	30-Sep-24 (Unaudited)	31-Dec-23 (Unaudited)	31-Dec-24 (Unaudited)	31-Dec-23 (Unaudited)	31-Mar-24 (Audited)
Revenue from operations	18.91	9.37	1.82	20.21	278.05	218.42
Other Income	18.91	9.37	1.82	20.21	278.05	218.42
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items)	8.78	(21.71)	(3.87)	(21.12)	259.30	292.36
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items)	8.78	(21.71)	(3.87)	(21.12)	259.30	292.36
Net Profit/(Loss) for the period after tax (after tax) and other comprehensive income (after tax)	(27.91)	(21.19)	(3.44)	(54.89)	230.44	302.44
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	179.70	7.11	(498.19)	486.35	281.20	311.84
Prepaid equity Share Capital	731.55	731.55	731.55	731.55	731.55	731.55
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	3559.60	3395.67	3057.13	3559.60	3057.13	3089.02
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic:	(0.38)	0.11	(6.81)	(0.75)	3.84	4.25
Diluted:	(0.38)	0.11	(6.81)	(0.75)	3.84	4.25

Notes:
1. The above is an extract of the detailed format of third quarter and nine months ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the Stock Exchange website: www.bseindia.com & on company's website: www.disharesourcesltd.com. Also the same can be accessed by scanning the QR code provided below.
2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 14th February, 2025. The statutory auditors of the company have carried out the Limited review report of the aforesaid results and have issued a modified opinion.
3. There has been no change in the accounting policies of the company which may have an impact on the net profit/loss, total comprehensive income or any other relevant financial items.
4. The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from April, 2017. Accordingly the Financial Results for the Quarter ended on 31st December, 2024 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

Date: 14-02-2025
Place: Ahmedabad

FOR, DISHA RESOURCES LIMITED
KRISHNA AVTAR KADRA
MANAGING DIRECTOR
DIN: 00650817

TAYLORMADE RENEWABLES LIMITED

TAYLORMADE RENEWABLES LIMITED					
Regd. Office: 1201 to 1215, 12th Floor, Solitaire Connect, Nr. BMW Showroom, S.G. Highway, Makarba, Ahmedabad-380051, Gujarat, India. Phone: +91 79 40040888, Email: info@tsm-india.com Website: tsmindia.com, CIN: U29307G2010PLC061759					
EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & NINE MONTH ENDED ON DECEMBER 31, 2024 (Rs. In Lacs)					
Sr. No.	Particulars	Quarter Ended			Nine Month ended
		31.12.2024	31.12.2023	31.12.2023	
1	Total Income from Operations	1625.48	22.01	5136.81	
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	301.50	-739.94	843.71	
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	301.50	-739.94	843.71	
4	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	301.50	-739.94	843.71	
5	Net Profit/(Loss) for the period after TAX (after Exceptional and/or Extraordinary items)	195.5	-736.55	592.07	
6	Total Comprehensive Income	1109.29	1098.74	1109.29	
7	Equity Share Capital	1109.29	1098.74	1109.29	
8	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	
9	Earnings Per Share (after extraordinary items) (Face value of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic & Diluted	1.76	-6.64	5.34	

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
2. The full format of financial results are available on the Website of BSE Limited at www.bseindia.com and also on the website of company www.tsmindia.com.

Date: 14-02-2025
Place: AHMEDABAD

FOR, TAYLORMADE RENEWABLES LIMITED
Sd/-
DHARMENDRA SHARAD GOR
MANAGING DIRECTOR
DIN: 00466634

Maruti Infrastructure Limited

Maruti Infrastructure Limited					
Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2024 (Rs In Lakhs except EPS)					
Sr No.	Particulars	Quarter ended		Nine Months ended	
		31-12-2024	31-12-2023	31-12-2024	31-12-2023
1	Total Income from Operations	1,388.60	1,089.29	2,819.04	2,541.00
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	64.09	116.79	43.61	338.75
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	64.09	116.79	43.61	338.75
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	47.96	79.88	13.08	250.90
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	47.96	79.88	13.08	250.90
6	Equity Share Capital	1,875	1,750	1,875	1,750
7	Other Equity Reserves per equity shares	-	-	-	-
8	Basic:	0.05	0.09	0.01	0.27
9	Diluted:	0.05	0.09	0.01	0.27

Notes:
1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and nine months ended on 31st December, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the quarter and nine months ended on 31st December, 2024 are available on the Stock Exchange website i.e., www.bseindia.com and on the website of the company i.e., www.marutinfra.in. The same can be accessed by scanning the QR code provided below.
2. Pursuant to approval of the members of the Company at their 20th Annual General Meeting held on 28.07.2024:
(i) Sub-division / Split of existing 3 (One) Equity Shares of face value of ₹ 10/- each into 5 (Five) Equity Shares of face value of ₹ 2/- each.
(ii) Authorised Share Capital of the Company was increased from ₹ 14 Crores to ₹ 20 Crores.
(iii) Bonus issue of 3,12,50,000 equity shares of face value of ₹ 2 each as bonus shares in the proportion of one bonus equity share of face value of ₹ 2 each for every two equity share of face value of ₹ 2 held on the record date i.e August 9, 2024 was allotted by capitalising an amount of ₹ 6,25,00,000/- from reserves. The Bonus shares have been listed on BSE Limited and ranked pari passu with the existing equity shares.
3. The above changes are reflected in the Earnings per share (both basic and diluted) for all reporting periods.

Date: 13th February, 2025
Place: Ahmedabad

FOR, Maruti Infrastructure Limited
Sd/-
Nimesh D Patel
Chairman & Managing Director
(DIN: 00185400)

802, Summit, Opp. Reliance Mart, Iscon Cross Road, S. G. Highway, Ahmedabad-380015 Phone: 079-40093482
E-mail:maruti_infra@yahoo.com, Website: www.marutinfra.in
CIN: L45100G1994PLC023742

તંત્રીશ્રીના કલમે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ બનશે, આ નામો પર ચર્ચા

દિલ્હીમાં મહા ગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જાત તરફ આંધળ વધી રહ્યું છે. અંદાજે ૨૦ વર્ષ બાદ દિલ્હીની સત્તા પર ભાજપની શાસકતા એન્ટી થાઈ છે. આ દરમિયાન હવે એ સવાલ પર ચર્ચાએ જોરે પકડ્યું છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે? દિલ્હીમાં ૨૦ વર્ષની કુશળ સમાપ્ત થવા બાદ ભાજપ શાસનની રક્ષા કરીને સત્તા પર આવી શકે? આ સંદર્ભમાં વિચારણાના આગળ આવી રહ્યા છે. સુદેશી લાભારતી પ્રવેશ સમયે સિલ્ક વર્મા જેવા નેતાઓના નામો જ નથી પણ દિલ્હીના શાસક શક્તિશાળી મંત્રીઓના નામો પણ આગળ આવી રહ્યા છે. જે કે, લાંબી પાલિમાં AAP (AAP) કોઈને ભાજપમાં જોડાવાના પક્ષ નેતાઓના નામ પણ દેખાઈ રહ્યા છે. ભાજપની આ જાતમાં મલિકા મલ્હારોની મોટી કામો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અહીં સ્પિનિંગ માન્યમંત્રી પર મલિકા નેતાના ખાતામાં જઈ રહ્યા છે. પર્વતી સુખા સ્વરાજના સ્વર્ણમંત્રી પણ મુખ્યમંત્રી આવા હતા. આ સમયે તેમની દિલ્હી ખાંસુરી સ્વર્ણમંત્રી નામ સામેલ કરવામાં આવ્યું છે. સુનિત ઠીરાની અને મેનાશી લેખાની પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે.

જો પ્રવેશ વર્માની વાત કરીએ તો સૌથી મોટું કારણ એ છે કે બીજાઓને તેમની નવી દિલ્હી સીટ પરની અવિરલ કેટરીવાલ સાથે મેલમાં આવી શકે. પૂર્વ સંપર્કમાં સહિત વર્માના પુત્ર મહેશ્વરીની જે વખત સંપર્કમાં અને પારસભાઈ તરીકે કામ કર્યું છે. કાલકાળમાં દિલ્હીના મુખ્યમંત્રીની અભિવૃદ્ધિ પરદાનાર ભાજપના પૂર્વ સાંસદ રમેશ જિયુડિયું નામ પણ ચર્ચામાં છે.

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારી સાથે તાજા જીલ્લા વખત ઉત્તર-પૂર્વ દિલ્હીની આંદોલન તરીકે જોવામાં આવે છે. આ વખતે ભાજપ દિલ્હીની સામનોજી જ લોકસભા બેઠક પર તેના ઉમેદવારો બદલાયા હતા, પરંતુ મનોજ તિવારીની ડિટીટ કરવામાં આવી ન હતી.

પર્વતી પૂર્વ પ્રવેશ અધ્યક્ષ, સરદાર જિલ્લા સરકાર પણ દિલ્હી ભાજપમાં એક મોટું નામ છે અને પર્વતીને તેમને મલિકા વિવાદ નાગર પર વલિદ AAP નેતા સામેના આરોપ સાથે મેલમાં આવી શકે. ૨૦૧૫ આ કોંગ્રેસના પક્ષ રાજીની આગેવાની તરીકે પાનાર ભાજપના રાજીવ સહિત તેમને પારસભાઈ મનોજિર સિલ સિસાનું નામ પણ સામેલ છે. લાલમજી જ ભાજપમાં જોડાયા પૂર્વ AAP મંત્રી કેશવ જોશી અને ભાજપના રોહિતોના પારસભાઈ વિજેન્દ્ર ગુપ્તાને લઈને પણ ચર્ચામાં જોરસારથી ચાલી રહી છે.

વિકી-અક્ષય એકબીજાનો ચહેરો પણ જોતાં નહોતાં

વિકી કોશ્યક 'જાવા'ની આનુરૂપી રાજ જોવાઈ રહી છે. આ એનિસાહકિત ફિલ્મમાં વિકી અને રશિમ મેઘાના રોલ્સ કુલ પહેલાં જી છવાઈ ગયા છે. ૧૪ કેમ્પનારોએ આ ફિલ્મ રિલીઝ કરી હતી છે, એ પહેલાં ટાઈટલાં ઉપલક્ષમાં વધારો કરવા માટે વિકીને તેના ઉપદેશાગ્રામ પર એક વીડીયો રજૂ કર્યા હતાં, જેની કેપ્શનમાં તેણે લખ્યું હતું, "જાવા કી દલ્હા, શુદ્ધ પે ગરજેલી, તો તલવર માટે બરેહાણ, તો શેરે દિવા ક્રા અને કે, આપે કી તરસ આયા કોં દેહી સિનેમાની સૌથી મોટી ફિલ્મને બધા ૧૦ દિવસ બધી છે. જાવા જ કે જીએરેલી એ રિલીઝ થવા છે." આ શેરે કરતાં જ કેસે તેને વધારી લીધી હતી અને ફિલ્મને અપારશી જ એકે બ્લોકબસ્ટર ફિલ્મ જાહેર કરી દીધી હતી. જાવાનું સંબંધ મહારાજાના જાવન પર આધારિત આ ફિલ્મમાં વિકી કોશ્યકે જાવાનું સંબંધ મહારાજાના રોલમાં મુશ્કેલી સાથે સંબંધિત છે. "પૂરે પાનના કી લાસ પે ખડી" હોર અને તાજ પેના યા, જેને દોનારા ઉપેલી વખત પહેલેને જાવા સાથે કી ચીમી પૂરે ફિલ્મનારમાં મુજેલી છે. "પૂરે કેશવકે આંદોલન એવા પેના કી કે પડા પર દુખની બજાર નહોતી શકે તે માટે અક્ષય અને વિકીએ શુદ્ધ મહારાજાને એકબીજા સાથે વાત નહોતી કરી અને એકબીજાને મહેરો પણ જોવા માંડ્યા હતા. ફિલ્મના રિલિઝ બંધના ઉદ્દેશ્યે એ ઉપદેશાગ્રામ જણાવ્યું છે, "બોલે જે રીતે આંધોળખનું પાન ભણવ્યું છે, એ જોઈને તમને પરેશ ૧૨ લાગશે. એ પછી આંધોળખને પરંતુ એની આંધોળખી અભિનય કરી જાય છે. એ શુદ્ધ સારી વ્યક્તિ છે. એ થઈને આંધોળખી કમ કરે છે, પરંતુ એ જે કરે છે તે પુરા દિવાની કરે છે." અક્ષય સાથે કમ કરવાના અનુભવ વિશે વાત કરતા ઉદેશ્યે કહ્યું, "આંધોળખને છબતી સંબંધ મહારાજાને સાથે અને પકડતાં નામ વધે લાગ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથેની થોટો ટિપ્પણી કરવાની છે, ફિલ્મમાં અક્ષય અને વિકીના સાથે કેશવકે સીન છે, પરંતુ ફિલ્મ તે બંને એકબીજાનો સામનો કરવા કેશવ અક્ષર છે, એ વિશે છે. તેથી દિલ્હી પણ આ બંને એકબીજાની આગમન સામનો અને આની કેશવકે રહેશે. આંધોળખના પાનમાં જે રીતે તેમને નાખ્યાં અને ચાલકી લાવાવામાં આવી છે, તેને સંબંધ મહારાજાની દુલ્હા સાથે અનુભવ મિશ્રણ છે." તેના અમલ-સામને સાંભળ્યા શુદ્ધ એ જોશ્યકે ઉદેશ્યે કહ્યું, "જે દિવસે તેમનું એકબીજા સાથે શુદ્ધ થવાનું હતું એ જ દિવસે એ બંને એકબીજા સાથે પાનો તરીકે જ થયા હતા, એ પહેલાં અમે એકબીજાને જુ મોડિંગના, ડાડે કે કેલો પણ કહ્યું નહોતું. એ આંધોળખ હતા અને હું સંબંધ મહારાજ અને અમે સાથે આ સાંભળ્યા શુદ્ધ માટે જ અગ્ય હતા.

દિના પાના પરિવારમાંથી કોઈએ મને મોતીનો ધમકી આપી : રોજિલા પાન

દિના પાન રોજિલા પાન જે રહે કેસરનો બહારૂરીથી સામનો કરી રહી છે અને સોશિયલ મીડિયા પર તેની અપરેશન કરે કરતી રહી છે. થોડાં વખત પહેલાં રોજિલા પાને દિના પાનની ટીકા કરી હતી અને તેની શિલ્પિતે એ દિના અતિરેખિત કરી રહી હોવાનો અને બીમારીનો ગેરલાભ ઉઠાવતી હોવાની વાત કરી હતી. તાજેતરની ઉપદેશાગ્રામ રોજિલાને આ નિવેદન પછીની શિલ્પિતે વાત કરી છે, તેણે કહ્યું કે સમય કેસરે તેના માટે કેસર અપરેશન કર્યું. તેણે કહ્યું કે તેણે આ વાત કહી પછી મારી નાખવાની ધમકી મને અન્ય પરિવારના કોઈક સાથે આવી છે, જેનો સામનો કરવો અશક્ય થઈ ગયો છે. રોજિલા કહે છે કે તેણે દિના પાનની અને સોશિયલ મીડિયા પર તેને અપરેશન કર્યું છે. આથી ભાડી છે અને મારી નાખવાની તેમજ એકાદ કેસર જેવું કામ કરવાના કરવાની ધમકીનો પણ આવી છે. તેણે અન્ય પણ કહ્યું કે તેના માટે આ ધમકીનો અસરકારક થઈ રહી છે. રોજિલાને આગળ કહી કે તેને કેસર કહ્યું, જેનાથી વિવાદ ધમકી થઈ રહી છે, તેણે કહ્યું કે તેને ખબર નથી આ ધમકીનો અને અપરેશન પછળ કદાચ દિના પાનની નજીકના લોકો કે, કોઈ પરિવારનો અને નિમો. તેણે કહ્યું કે આ ધમકીઓથી તેના માનસિક શાંતિભાંગ થઈ છે. રોજિલાને તેણે પણ એક કેસર સર્વાઈવર છે. તેને દિનાની સારવાર આરોગ્યની દૃષ્ટિએ અને વ્યવહારિક દૃષ્ટિએ યોગ્ય ન હોવી તેથી તેણે આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રોજિલાને કહ્યું હતું કે પોતે એક કેસર સર્વાઈવર તરીકે તેને દિનાની વાત ગેરવ્યાજની લાગી હતી. તેણે કહ્યું હતું કે દિનાની વાતથી દિના પાનનાર અંગે તેને કોઈ સારવાર અને ગેરલાભનો અને મોટી માસિકી લાગી રહી છે. રોજિલાને આ ધમકીઓ અને અપરેશનની પડવકા પછી દિના શુદ્ધ પાન આ શુદ્ધ દિના તરફથી સ્વચ્છતાની માંગણી કરી છે. એક જાણીતી વ્યક્તિ તરીકે સાચું અને જવાબદાર રહેવું એ જાણીતી જવાબદારી છે. આટલા કલાક આ સારવારમાં થતાં નથી

PPC 2025એ દેશભરમાં પ કરોડ ભાગીદારી સાથેનો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી, આ વર્ષે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ૩૯ વિચારણીઓની પસંદગી કરવામાં આવી છે. જે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ બોર્ડ સંકારી સ્કૂલો, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, સૈનિક સ્કૂલ, કેન્દ્રીય મોલ રહેણાંક સ્કૂલ, સીબીએસઈ અને નવોદય વિદ્યાલયમાંથી વિચારણીઓની પસંદગી કરાઈ છે. જેમાંથી કેશવકે વિચારણીઓ પ્રેરણા સાથે કાર્યક્રમના મુખ્યપૂર્વ વિચારણી છે. કલા ઉલ્લેખ અને વીર ગાનાના વિજેતાઓ છે. આ વિચારણીઓને પ્રધાનમંત્રી સાથે સીધા જોડાવા માટે પહેલ કરવામાં આયા છે - જે આ આયુર્વિદ્યા અને સમવેશકાનું સાચું પ્રતિબિંબ બનાવે છે. એક નવો પિત્તાલ ઉમેરેને PPC

20૨૨ અઠ એપિલોમાં એક નવા રોમમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પ્રધાનમંત્રી સાથેની પહેલી વખતથી સીબી સુદર્યાના, સ્વયં, સ્વયંપ્રધાના, કે વ્યુટુલ વેલ અને શિક્ષણ મંચલય અને માનસિકી અને પ્રચારક મંચલયની સોશિયલ મીડિયા વેબસાઇટ પર સીબી પ્રચારિત કરવામાં આવશે. જેથી સમગ્ર દેશભરના દર્શકો આ સમુદ્ધ અનુભવના ભાગ બની શકે.

PPCને જન અંદોલન બનાવવાની સાથે, આપણા વાચકોની સારીરિક અને માનસિક સુખાકારીની નોંધપાત્ર સમુદાય જોડાવા દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. તે મુજબ, તેની આયુર્વિદ્યા એટલે કે, PPC૨૦૨૫માં વિવિધ શૈલીની પ્રખ્યાત સ્તરોનો સામેલ કરવો. જેઓ

રમતગમત અને ફિટનેસ એમ સી શ્રેની કોમ, અત્યંત લેવાર અને સુલભ પરીવારો દિલ્હી દ્વારા એવા નિર્ધારણ, સ્થિતિસ્થાપક અને સ્થાય વ્યવસ્થાન વિશે વાત કરવા માટેની માનસિક સ્વાસ્થ્ય ટ્રીપ્લો પાર્ટીકીપાનના કલ્યાણ અને

ગુણવેલ કુલ પ્રોફિટકેસ લિમિટેડ
(અપડેટ મહત્ત્વ સાથેની વાર્ષિક રીપોર્ટ કી જાણકારી)

રજીસ્ટર્ડ ઓફિસ : પ્લોટ નં. ૧, એ, સેક્ટર ૨૬, ૨૦૦, સુબરોહિત ઈસ્ટ, નોંધ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૬૦૨.
CIN: L1510GJ1995PLC020699. (M) : 98989 0862, Website : www.metalshousing.com, Email : metalshousingfinancials@gmail.com
તા. ૧૫.૦૨.૨૦૨૫ નો રોજિલા પાનના અપરેશન અને વિકાસ માટેના ઓર્ગેનાઈઝેશનના પર્સનલના પર્સનલના અપરેશન (સં. ભાગમાં)

સ. નં.	વિગત	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)
1.	સામાજિકીય કુલ વાસ્તુ (સીબી)	0.00	0.00	0.00	204.60	0.00
2.	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	(5.36)	(5.36)	(4.46)	(14.70)	(14.42)
3.	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	(5.36)	(5.36)	(4.46)	(14.70)	(14.42)
4.	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	(5.36)	(5.36)	(4.46)	(14.70)	(14.42)
5.	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	(5.36)	(5.36)	(4.46)	(14.70)	(14.42)
6.	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	(5.36)	(5.36)	(4.46)	(14.70)	(14.42)
7.	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	30.82	30.82	30.82	30.82	30.82
8.	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	0.17	0.17	0.14	0.48	0.47
9.	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	0.17	0.17	0.14	0.48	0.47

અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)

અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)

ગુણવેલ કુલ પ્રોફિટકેસ લિમિટેડ

અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)

વર્ષ	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)
2024	18.91	0.12	1.62	20.21
2023	3.37	1.82	23.46	418.79
2022	8.78	(21.71)	(3.87)	21.12
2021	8.78	(21.71)	(3.87)	21.12
2020	(27.91)	(21.19)	(3.44)	(54.89)

ગુણવેલ કુલ પ્રોફિટકેસ લિમિટેડ

અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)

વર્ષ	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)
2024	18.91	0.12	1.62	20.21
2023	3.37	1.82	23.46	418.79
2022	8.78	(21.71)	(3.87)	21.12
2021	8.78	(21.71)	(3.87)	21.12
2020	(27.91)	(21.19)	(3.44)	(54.89)

ગુણવેલ કુલ પ્રોફિટકેસ લિમિટેડ

અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)

વર્ષ	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)	અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)
2024	18.91	0.12	1.62	20.21
2023	3.37	1.82	23.46	418.79
2022	8.78	(21.71)	(3.87)	21.12
2021	8.78	(21.71)	(3.87)	21.12
2020	(27.91)	(21.19)	(3.44)	(54.89)

SHUBHAM POLYSYPIN LIMITED

(CIN: L1720GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jethpura - Bantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamgrp.com Website: www.shubhampolysypin.com

SHUBHAM POLYSYPIN LIMITED

અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)

Particulars	Quarter ended on 31-12-2024 (Unaudited)	Quarter ended on 30-09-2024 (Unaudited)	Quarter ended on 31-03-2023 (Audited)	Year ended on 31-03-2024 (Audited)
Total Income from operations	1480.71	1498.97	1136.51	5078.56
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	20.09	16.80	27.12	123.29
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	20.09	16.80	27.12	123.29
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	18.51	12.02	20.09	86.43
Net Profit / (Loss) for the period (after Tax and other Comprehensive Income (after tax))	18.51	12.04	20.09	86.46
Equity Share Capital	1212.20	1212.20	1212.20	1212.20
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	-	234.54
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.15	0.10	0.17	0.69
Basic & Diluted	0.15	0.10	0.17	0.69

SHUBHAM POLYSYPIN LIMITED

(CIN: L1720GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jethpura - Bantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamgrp.com Website: www.shubhampolysypin.com

SHUBHAM POLYSYPIN LIMITED

અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)

Particulars	Quarter ended on 31-12-2024 (Unaudited)	Quarter ended on 30-09-2024 (Unaudited)	Quarter ended on 31-03-2023 (Audited)	Year ended on 31-03-2024 (Audited)
Total Income from operations	1480.71	1498.97	1136.51	5078.56
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	20.09	16.80	27.12	123.29
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	20.09	16.80	27.12	123.29
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	18.51	12.02	20.09	86.43
Net Profit / (Loss) for the period (after Tax and other Comprehensive Income (after tax))	18.51	12.04	20.09	86.46
Equity Share Capital	1212.20	1212.20	1212.20	1212.20
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	-	234.54
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.15	0.10	0.17	0.69
Basic & Diluted	0.15	0.10	0.17	0.69

SHUBHAM POLYSYPIN LIMITED

(CIN: L1720GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jethpura - Bantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamgrp.com Website: www.shubhampolysypin.com

SHUBHAM POLYSYPIN LIMITED

અપરેશન કરવામાં આવેલું છે (અપરેશનમાંથી)

Particulars	Quarter ended on 31-12-2024 (Unaudited)	Quarter ended on 30-09-2024 (Unaudited)	Quarter ended on 31-03-2023 (Audited)	Year ended on 31-03-2024 (Audited)
Total Income from operations	1480.71	1498.97	1136.51	5078.56
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	20.09	16.80	27.12	123.29
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	20.09	16.80	27.12	123.29
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	18.51	12.02	20.09	86.43
Net Profit / (Loss) for the period (after Tax and other Comprehensive Income (after tax))	18.51	12.04	20.09	86.46
Equity Share Capital	1212.20	1212.20	1212.20	1212.20
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	-	234.54
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.15	0.10	0.17	0.69
Basic & Diluted	0.15	0.10	0.17	0.69

SHUBHAM POLYSYPIN LIMITED

(CIN: L1720GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jethpura - Bantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamgrp.com Website: www.shubhampolysypin.com

SHUBHAM POLYSYPIN LIMITED

(CIN: L1720GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jethpura - Bantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamgrp.com Website: www.shubhampolysypin.com

SHUBHAM POLYSYPIN LIMITED

(CIN: L1720GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jethpura - Bantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamgrp.com Website: www.shubhampolysypin.com

SHUBHAM POLYSYPIN LIMITED

(CIN: L1720GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jethpura - Bantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamgrp.com Website: www.shubhampolysypin.com

SHUBHAM POLYSYPIN LIMITED